

સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)

આધસ્થાપક : ગુરુદેવ પ.પૂ.બાપજી | પ્રેરક : ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

મહિમા વર્ષ

૨૦૨૧-૨૨

ઉપક્રમે

મે માસ

ગુણગ્રાહક માસ

Family Time સભા - 2
કાર્યક્રમ મટીરીયલ



મહિમા વર્ષ

ઉપક્રમે

ગુણગ્રાહક માસ

આ માસમાં અમલમાં મૂકવાના PLના મુદ્દા

- (1) દરરોજ ઠાકોરજી જમાડતી વખતે સંતો-હરિભક્તોના ગુણાનુવાદ કરવા (તેમાંય જેમની સાથે વિશેષ રહેવાનું થતું હોય, જેમના વિશેષ અભાવ-અવગુણ આવતા હોય તેમના ગુણાનુવાદ કરવા.)
- (2) અભાવ-અવગુણ અને અમહિમાની વાત ન કરવી, ન સાંભળવી, ન વિચારવી કે અભાવ-અવગુણની વાતોમાં ભેગા પણ ભળવું નહિ.

❖ ગુણગ્રાહક દ્રષ્ટિ એટલે...

- ગુણગ્રાહક દ્રષ્ટિ એટલે ગુણોના ગ્રાહક થવું.
- ગુણગ્રાહક દ્રષ્ટિ એટલે ભર્યા થવાનો એકમાત્ર ઉપાય.
- ગુણગ્રાહક દ્રષ્ટિ એટલે પ્રભુમાં પ્રીતિ થવાનું સૌથી મોટું કારણ.
- ગુણગ્રાહક દ્રષ્ટિ એટલે સમૂહજીવનમાં રહેવા છતાં સુખિયા રહેવાનો એકમાત્ર ઉપાય.
- ગુણગ્રાહક દ્રષ્ટિ એટલે સદાય આનંદમાં રહેવાનો જાદુઈ ઈલાજ છે.
- ગુણગ્રાહક દ્રષ્ટિ એટલે સૌના વ્હાલા થવાની તરકીબ.
- ગુણગ્રાહક દ્રષ્ટિ એટલે વિના પ્રયાસે ગુણસભર થવાની કળા.
- ગુણગ્રાહક દ્રષ્ટિ એટલે વિના આવડતે આવડતવાળા થવાની તરકીબ.



❖ **Family Time** સભા ક્યારે અને કેવી રીતે કરવી ?

ઘરના સૌ સભ્યો ભેગા થઈ શકે તે મુજબ ગુરુવારના દિવસે Family Time સભાનું આયોજન કરવું અને Family Time સભા માટે સમય નક્કી કરવો અને તે મુજબ સભા કરવી.

નોંધ :- જે સેન્ટરમાં અઠવાડિક સભા ગુરુવારના રોજ થતી હોય તેવા સેન્ટરના હરિભક્તોએ શુક્રવારે Family Time સભાનું આયોજન કરવું.

- નાનાએ વડીલોને ચરણસ્પર્શ કરી તથા વડીલોએ નાનાને બે હાથ જોડી નમસ્કાર કરી સભામાં બેસવું.
- “ઘર એક મંદિર” હોવાથી ઘરમાં અનુકૂળ સ્થળે સભા કરી શકાય.
- સભાને અંતે સૌએ એકબીજાને હાથ જોડી અરસપરસ ‘દયાળુ રાજી રહેજો’ એવી સાચા ભાવે પ્રાર્થના કરવી.
- મહિલા-પુરુષ સભ્યોએ મર્યાદા રાખીને બેસવું.

મારા વાલાજી શું વાલપ દીસે રે...

મારા વાલાજી શું વાલપ દીસે રે, તેનો સંગ શીદ તજીએ;
તે હ વિન। કે ને ભજીએ રે ... તેનો ટેક
સન્મુખ જાતાં શંકા ન કીજે, મર ભાલા તણા મેહ વરસે રે;
હંસ જઈ હરિજનને રે મળશે, કાચી તે કાચા પડશે રે... તેનો ૦૧
શૂળી ઉપર શયન કરાવે, તોયે સાધુને સંગે રહીએ રે;
દુરિજન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખદુઃખ સર્વે સહીએ રે... તેનો ૦૨
અમૃત પે અતિ મીઠાં મુખથી, હરિનાં ચરિત્ર સુણાવે રે;
બ્રહ્મા ભવ સનકાદિક જેવા, જેનાં દર્શન કરવા ન પાવે રે... તેનો ૦૩
નરકકુંડથી નરસું લાગે, દુરિજનનું મુખ મનમાં રે;
મુક્તાનંદ મગન થઈ માગે, વ્હાલા વાસ દેજો હરિજનમાં રે... તેનો ૦૪

વિડીઓ કીર્તનનું દર્શન અને શ્રવણ કરવા માટે નીચે આપેલ મૂર્તિ પર ક્લિક કરવું.



આવો

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ

અભાવ-અવગુણનું આવવાનું કારણ તપાસીએ અને
તે ટાળવા માટેના ઉપાય કરીએ.



ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી



દિવ્યવાણીનું શ્રવણ કરવા માટે ઉપર
આપેલ મૂર્તિ પર ક્લિક કરવું.



પામીએ પ્રેરણા

અપરાધનું ફળ

સદ્. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હરિભજનાનંદ સ્વામી. તેમને સેવાનું ખૂબ અંગ. જૂનાગઢ મંદિરનું કામ ચાલતું હતું. તનતોડ સેવા કરે. અઘરામાં અઘરી સેવા એટલે પથ્થર કાપવાની સેવા. એ પથ્થર કાપવાની સેવા ખૂબ ખંતથી અને ધગશથી કરે. સેવા કરતાં કરતાં એમના હાથ એટલા કડક થઈ ગયેલા કે આંગળા કે મુઠ્ઠીઓ વળે જ નહીં. આખું જીવન ખૂબ સેવા કરેલી. પરંતુ તેમનાથી સંતો-ભક્તોનો અપરાધ બહુ થઈ ગયેલો. તેની શિક્ષારૂપે અંત અવસ્થાએ બહુ પીડાય. પીડા સહન જ ન થાય. એક વખત સદ્. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધાર્યા. સ્વામીનાં દર્શન થતાં જ પોક મૂકીને રડ્યા, “મને આ રોગમાંથી મુક્ત કરો. સહન નથી થતું. ગમે તે કરો, મને બચાવો.” સ્વામી કહે, “તમારો સ્વભાવ તમને નડે છે તમે જેટલાની ઉપર ગુસ્સો કર્યો છે, જેને જેને દુભવ્યા છે, સર્વેની એક એકની જઈને માફી માગો. એમને પોકાર કરો. એ રાજી થશે તો જ તમને પીડામાંથી મુક્તિ મળશે.” સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ બતાવેલા ઉપાય મુજબ એક એક સંત-હરિભક્તની બે હાથ જોડી કગરીને ખૂબ માફી માગી ખાતું ચૂકતે કરાવ્યું. ત્યારબાદ અંતે 2-5 મહિને મહારાજ તેમને ધામમાં તેડી ગયા.

મનનીય પ્રશ્નો

- (1) હરિભજનાનંદ સ્વામીએ ઘણી સેવા કરી હોવા છતાં શરીરમાં કેમ રોગ આવ્યો ?
- (2) સત્સંગમાં આવી આટલી બધી સેવા કરવા છતાં ધ્યાન-ભજનમાં સુખ નથી આવતું તેનું કારણ તપાસો. (સ્વજીવન ચકાસણી માટે 2 મિનિટનો સમય આપવો.)
- (3) નાની નાની કેવી કેવી બાબતોમાં સત્સંગમાં તથા પરિવારમાં અવગુણ લેવાઈ જાય છે ? એવા સમયે શું કરવું ?

લેશન : કોઈના અભાવ-અવગુણ લેવા નહીં ને જોવા નહીં.

આવો સંકલ્પ સભાના સારનું શ્રવણ કરીએ...



આવો ગુણગ્રાહક માસનું લેશન કરીએ...

